

-: અખબારી યાદી:-

## તા. ૨૫-૦૯-૨૦૨૨નાં રોજ “સ્વનિધિ સ્નેહમિલન મહોત્સવ” યોજાયો.

તારીખ: ૨૬-૦૯-૨૦૨૨

રાજ્ય સરકારશ્રી તરફથી મળેલ સુચના અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકા કક્ષાએ તા.૨૫/૦૯/૨૦૨૨નાં રોજ પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ પી.એમ. સ્વનિધિ યોજના દ્વારા સમર્થિત શેરી ફેરિયાઓની ઓળખ કરી ધિરાણ મેળવેલ ફેરિયાઓની સારી ઈમેજ , ડીઝીટલ ટ્રાન્ઝેક્શન માટેની વ્યવહાર કુશળતા વગેરે ધ્યાને લઈ ફેરિયાઓને આમંત્રિત મહેમાનો સાથે સંવાદ યોજી તેમજ આ મહોત્સવ દરમિયાન ફેરિયાઓ અને તેમના પરિવારને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ કરી પારિવારિક માહોલ બને તે છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫/૦૯/૨૦૨૨નાં રોજ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે સમય સાંજનાં ૦૪:૦૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે “સ્નેહ મિલન” કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ માન. મેયર ડૉ. પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા તથા ડેપ્યુટી કમિશનર શ્રી ચેતનભાઈ નંદાણી, આસી. સહાયક કમિશનરશ્રી એચ. આર. પટેલ, આસી. મેનેજરશ્રી કે. ડી. વાઢેર, શ્રી એન. એમ. આરદેસણા ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહમિલન સમારોહમાં મેયરશ્રી ડૉ. પ્રદિપ દવએ જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાન તથા ગુજરાતના માન, મુખ્યમંત્રીએ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર કરવા પીએમ સ્વનિધિ યોજનાનો આરંભ કરવામાં આવેલ. આ યોજનાનાં લાભથી નાનામાં નાનો વ્યક્તિ લોન મેળવી પોતાની આજીવિકા પુના:સ્થાપિત કરી શકે છે. જેથી તેમના બાળકો પણ સારી સ્કુલમાં ભણી શકે. આ અંગે ની ચિંતા ભાજપ સરકારે કરી છે. આ ઉપરાંત વ્યક્તિ બીમાર પડે ત્યારે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આયુષ્માન ભારત યોજના થાકી લાભ મેળવી શકે છે અને અંતે અપીલ કરતાં જણાવ્યું કે આ યોજનાનો લાભ વધુમાં વધુ મેળવો તથા તમારા આજીબાજુના જરૂરીયાત મંદ વ્યક્તિને આ યોજના અંગેની માહિતી પુરી પાડે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા ઉદબોધન કરતા કહ્યું કે જ્યાં માનવી ત્યાં સુવિધાએ આપણા માન. વડાપ્રધાનશ્રીનું સુત્ર છે. તેને સાર્થક કરવા તથા કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ શેરી ફેરિયાઓને પગભર બનાવવા તથા છેવાડાના ફેરિયાઓને આ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળે તે

હેતુથી આ કાર્યક્રમ નો આયોજના કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓ વધુ ને વધુ આ યોજનાનો લાભ મેળવે અને આત્મનિર્ભર થાય.

આ કાર્યક્રમમાં રાજુભાઈ ગઢવી (લોક સાહિત્યકાર) અને તેમની ટિમ દ્વારા લોક ડાયરો રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ સમારોહના અધ્યક્ષ માન. શ્રી ડૉ.પ્રદીપ ડવ તથા મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું. શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા દ્વારા સ્વાગત પ્રવચન કરેલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ તેમજ રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં.૬૪ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

### PM SVANidhiયોજના (PM Street Vendors AtmaNirbharNidhi)

- ❑ ભારત સરકારશ્રી દ્વારા COVID-19 થી અસર ગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના થકી તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે આયોજના અમલીકૃત છે.
- ❑ આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/- તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે.
- ❑ આ યોજના હેઠળ ઓનલાઇન ડીજીટલ ટ્રાન્જેક્શન વેગ મળે તે હેતુ થી લાભ લીધેલ લાભાર્થીઓને મહત્તમ રૂ.૧૨૦૦ કેશ બેંક આપવામાં આવે છે.

### પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/- ની લોનની સિધ્ધિ

નોંધાયેલ ફેરિયાઓ	થયેલ અરજીઓ	ડીસબર્સ થયેલ લોન
૭૫૩૪	૧૮૫૧૮	૯૪૮૯

### “સંકલ્પ સે સિધ્ધિ” અંતર્ગત બીજા તબક્કામાં પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીને

### રૂ.૨૦,૦૦૦/- લોનની સિધ્ધિ

Loan Completion by Bank	Applied for 2nd Loan	Disbursed by Bank
૨૧૦૫	૧૩૬૨	૧૦૨૪

ત્રીજા તબક્કામાં બીજી લોન પૂર્ણ થયેલ લાભાર્થીને રૂ.૫૦,૦૦૦/- લોનની સિધ્ધિ

Loan Completion by Bank	Applied for 3rd Loan	Disbursed by Bank
૧૭	૧૩	૦૬

“સ્વનીધી સે સમૃદ્ધિ” અંતર્ગત PM SVANidhi યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારો માટે સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે સામાજિક આર્થિક મૂલ્યાંકનની ઓનલાઇન પ્રોફાઇલીંગ કામગીરી

યોજનાનું નામ	સંલગ્ન વિભાગ/કચેરી	લાભાર્થી
પ્રધાનમંત્રી જનની સુરક્ષા યોજના	આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ	૧૨૧૧૫
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના	મહિલા અને બાળ વિકાસ વિભાગ	૦૨
વન નેશન વન રેશનકાર્ડ	પુરવઠા વિભાગ	૧૬૫૩
પ્રધાનમંત્રી જન ધન યોજના		૨૯૯૮
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના		૮૭૨૪
પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના		૧૦
પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના	શ્રમ અને રોજગાર વિભાગ	૪૨૬૭

આ વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે જરૂરીયાત અને પાત્રતા લક્ષમાં લઈ સંલગ્ન નોડલ એજન્સી સાથે સંકલન કરી યોજનાનો લાભ લાભાર્થીને મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે છે.

(પી.એ.ટુ મેયર)